



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૪/૦૧/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૭ કેસ કરી, ૪૬ વ્યક્તિઓને ઝડપી, ૧૭૨ લીટર દેશી દારૂ, ૫ બોટલ ઈંગ્લીશ દારૂ, ૯૮ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૭૪ બિયર ટીન અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૩ કેસ કરી ૨૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૦,૧૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૫૫/૧૯

ગોમતીપુર: રાસીદખાન નાસીરખાન પઠાણ (ઉ.વ.૨૪) (રહે.સુલેમાની ચાલી નુતનમીલ ચાર રસ્તા સરસપુર શહેરકોટડા) એ તા.૨૩/૦૧/૧૯ નારોજ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૮/૬/૨૦૧૮ થી તા.૧૦/૦૧/૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી સમીર સ/ઓ સીરાજ મિર્ઝા (રહે. મોળની પોળના નાકે દિલ્લીવાળા મિઠાઈની સામે કાલુપુર ટાવર રોડ કાલુપુર) એ રાસીદખાન પઠાણ તેમજ અન્ય લોકોને વિજય સેલ્સમાંથી ઇલેક્ટ્રોનિક આઇટમ અપાવી તે ઇલેક્ટ્રોનિક આઇટમ કસ્ટમરના ઘરેથી પાછી લઈ જઈ અને કસ્ટમરને લોભામણી સલાહ આપી તમારા ઘરે કેપીટલ ઇસ્ટમાંથી ફાયનાન્સ કંપનીનું કાર્ડ આવશે અને તમારી ક્રેડીટ વધી જશે અને જરૂર હોય તો બીજી લોન તાત્કાલીક મળશે તેવી લાલચ આપી ઇલેક્ટ્રોનિક આઇટમ લઈ જઈ ઓછી કિંમતમા બીજી વ્યક્તિઓને વહેંચી આશરે ૧૫,૦૦,૦૦૦/- ની છેતરપીડી કરી છે. આ ગુનાની તપાસ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૫૬/૧૯

વસ્ત્રાપુર: મનીષસિંઘ સીતેન્દ્રસિંઘ સિંઘ (ઉ.વ.૩૮) (રહે. દ્વારકેશ ગ્રીન ફ્લેટ આનંદનીકેતન સ્કુલ પાસે શીલજ) એ તા.૨૩/૦૧/૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૧/૧૯ કલાક ૦૦/૦૨ થી કલાક ૩/૪૦ વાગ્યા દરમ્યાન બોડકદેવ જજીસ બંગલા રોડ આકાશ ટાવર પ્રથમ માળ યુ જી એફ દુકાન નં ૧ નં ૩ નં ૭ નં ૮ ના શટરના તાળા તોડી અજાણી વ્યક્તિ દુકાનોમાથી મોબાઈલ ફોન નંગ-૧૩ કિંમત રૂપિયા ૧,૮૬,૦૨૫/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એન.પટેલ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૫૭/૧૯

“કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન: પંકજભાઈ રામવિલાસ શર્મા (રહે.પદમાલક્ષ્મી સોસાયટી મોની હોટલની પાછળ ઈસનપુર) એ “કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨૩/૦૧/૧૯ સવારના ૯/૩૦ વાગ્યાના સુમારે રહેણાંક નજીક પંકજભાઈનો અઢી વર્ષનો પુત્ર લક્ષીત રમતો હતો ત્યારે બોલેરો પીક અપ ગાડી નંબર જીજે ૨૭ એક્સ ૭૭૨૧ ના ચાલકે ગાડી પુરઝડપે અને બેદરકારીથી રિવર્સ ચલાવતા પંકજભાઈના પુત્ર લક્ષીતને ટક્કર વાગતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે તેને એલ.જી.હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડૉશ્રીએ મૃત જાહેર કર્યો હતો. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી જી.જે.રાઓલ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૫૮/૧૯

નારોલ: રીન્કેશકુમાર બીપીનચંદ્ર જોષી (રહે.નારોલ સરણીયાવાસ રામદેવ પીરના મંદીરની અંદર નારોલ) એ અગમ્ય કારણસર તા.૨૩/૦૧/૧૯ કલાક ૧૧/૩૦ વાગ્યાના સુમારે મંદીરના ઉપરના ભાગે આવેલ રૂમમાં પંખા સાથે કોમ્પ્યુટરનો વાયર બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી શંકરભાઈ હીરજીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.